

Date: 13th November, 2025

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir / Ma'am,

**Sub: Newspaper Advertisement of extract of Unaudited Financial results for the
Quarter and half year ended on 30th September, 2025**

Ref: Security Id: SHANGAR / Code: 540259

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 13th November, 2025 of extract of Unaudited Financial results for the Quarter and half year ended on 30th September, 2025 in:

1. English Newspaper – Business Standard Newspaper and
2. Regional Language Newspaper (Gujarati) – Jai Hind Newspaper

Kindly take the same on your record.

Thanking You,

Yours Faithfully

For, Shangar Decor Limited

MOULIN
SAMIR SHAH
Digitally signed by
MOULIN SAMIR SHAH
Date: 2025.11.13
11:18:29 +05'30'

Moulin Samir Shah
Director
DIN: 08948652

wedding decor – theme decor – exhibitions – religious & corporate events

CIN No. : L36998GJ1995PLC028139

4, Sharad Flats, Opp. Dharnidhar Derasar, B/h. Sales India, Paldi, Ahmedabad-380007.

(M.) : 98250 23622, 98250 31622

✉ shangardecorltd@hotmail.com, info@shangardecor.com 🌐 www.shangardecor.com

'SIR' ને સુપ્રીમમાં પડકારતા
તામિલનાડુ-પશ્ચિમ બંગાળ

નવી દિલ્હી: બિહારમાં મહાદ્વાર યાત્રીની સ્પેશલ-ટ્રેન્ડેસીવ રિવોલ્વર (સર)ની પ્રક્રિયા પૂરી થયા બાદ પોલીસે યાત્રીના પરિવારનાની રાહ છે અને મુશ્કેલ સંજોગોમાં ૨૨ રાત્રીઓમાં આ પ્રક્રિયા રાહ જઈ નહીં છે તે સમયેથી સંજોગો-૫ બંગાળ-ગોડામેલીની સરકારે યાત્રીપંચની આ પ્રક્રિયાને

[illegible]

ઈન્ડસ્ટ્રીઝ બેંક લિમિટેડ

જાહેર સહિત
 ૧) ઈ-વોટ (ઇલેક્ટ્રોનિક) નિયમ, ૨૦૦૨ના નિયમ ૩(૧) હેઠળ
 ૨) ઈ-સાધન મેકેટિંગ એન્ડ એપ્રોપ્રિયેટ એન્ડ ડિજિટાઇઝેડ ઈ-વોટ મેકેટ, ૨૦૦૨ની કાયદા ૧૩(૨) હેઠળ
 સહિતની વેબસાઇટ પરથી

[illegible]

© 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025, 2026, 2027, 2028, 2029, 2030, 2031, 2032, 2033, 2034, 2035, 2036, 2037, 2038, 2039, 2040, 2041, 2042, 2043, 2044, 2045, 2046, 2047, 2048, 2049, 2050, 2051, 2052, 2053, 2054, 2055, 2056, 2057, 2058, 2059, 2060, 2061, 2062, 2063, 2064, 2065, 2066, 2067, 2068, 2069, 2070, 2071, 2072, 2073, 2074, 2075, 2076, 2077, 2078, 2079, 2080, 2081, 2082, 2083, 2084, 2085, 2086, 2087, 2088, 2089, 2090, 2091, 2092, 2093, 2094, 2095, 2096, 2097, 2098, 2099, 2100, 2101, 2102, 2103, 2104, 2105, 2106, 2107, 2108, 2109, 2110, 2111, 2112, 2113, 2114, 2115, 2116, 2117, 2118, 2119, 2120, 2121, 2122, 2123, 2124, 2125, 2126, 2127, 2128, 2129, 2130, 2131, 2132, 2133, 2134, 2135, 2136, 2137, 2138, 2139, 2140, 2141, 2142, 2143, 2144, 2145, 2146, 2147, 2148, 2149, 2150, 2151, 2152, 2153, 2154, 2155, 2156, 2157, 2158, 2159, 2160, 2161, 2162, 2163, 2164, 2165, 2166, 2167, 2168, 2169, 2170, 2171, 2172, 2173, 2174, 2175, 2176, 2177, 2178, 2179, 2180, 2181, 2182, 2183, 2184, 2185, 2186, 2187, 2188, 2189, 2190, 2191, 2192, 2193, 2194, 2195, 2196, 2197, 2198, 2199, 2200, 2201, 2202, 2203, 2204, 2205, 2206, 2207, 2208, 2209, 2210, 2211, 2212, 2213, 2214, 2215, 2216, 2217, 2218, 2219, 2220, 2221, 2222, 2223, 2224, 2225, 2226, 2227, 2228, 2229, 2230, 2231, 2232, 2233, 2234, 2235, 2236, 2237, 2238, 2239, 2240, 2241, 2242, 2243, 2244, 2245, 2246, 2247, 2248, 2249, 2250, 2251, 2252, 2253, 2254, 2255, 2256, 2257, 2258, 2259, 2260, 2261, 2262, 2263, 2264, 2265, 2266, 2267, 2268, 2269, 2270, 2271, 2272, 2273, 2274, 2275, 2276, 2277, 2278, 2279, 2280, 2281, 2282, 2283, 2284, 2285, 2286, 2287, 2288, 2289, 2290, 2291, 2292, 2293, 2294, 2295, 2296, 2297, 2298, 2299, 2300, 2301, 2302, 2303, 2304, 2305, 2306, 2307, 2308, 2309, 2310, 2311, 2312, 2313, 2314, 2315, 2316, 2317, 2318, 2319, 2320, 2321, 2322, 2323, 2324, 2325, 2326, 2327, 2328, 2329, 2330, 2331, 2332, 2333, 2334, 2335, 2336, 2337, 2338, 2339, 2340, 2341, 2342, 2343, 2344, 2345, 2346, 2347, 2348, 2349, 2350, 2351, 2352, 2353, 2354, 2355, 2356, 2357, 2358, 2359, 2360, 2361, 2362, 2363, 2364, 2365, 2366, 2367, 2368, 2369, 2370, 2371, 2372, 2373, 2374, 2375, 2376, 2377, 2378, 2379, 2380, 2381, 2382, 2383, 2384, 2385, 2386, 2387, 2388, 2389, 2390, 2391, 2392, 2393, 2394, 2395, 2396, 2397, 2398, 2399, 2400, 2401, 2402, 2403, 2404, 2405, 2406, 2407, 2408, 2409, 2410, 2411, 2412, 2413, 2414, 2415, 2416, 2417, 2418, 2419, 2420, 2421, 2422, 2423, 2424, 2425, 2426, 2427, 2428, 2429, 2430, 2431, 2432, 2433, 2434, 2435, 2436, 2437, 2438, 2439, 2440, 2441, 2442, 2443, 2444, 2445, 2446, 2447, 2448, 2449, 2450, 2451, 2452, 2453, 2454, 2455, 2456, 2457, 2458, 2459, 2460, 2461, 2462, 2463, 2464, 2465, 2466, 2467, 2468, 2469, 2470, 2471, 2472, 2473, 2474, 2475, 2476, 2477, 2478, 2479, 2480, 2481, 2482, 2483, 2484, 2485, 2486, 2487, 2488, 2489, 2490, 2491, 2492, 2493, 2494, 2495, 2496, 2497, 2498, 2499, 2500, 2501, 2502, 2503, 2504, 2505, 2506, 2507, 2508, 2509, 2510, 2511, 2512, 2513, 2514, 2515, 2516, 2517, 2518, 2519, 2520, 2521, 2522, 2523, 2524, 2525, 2526, 2527, 2528, 2529, 2530, 2531, 2532, 2533, 2534, 2535, 2536, 2537, 2538, 2539, 2540, 2541, 2542, 2543, 2544, 2545, 2546, 2547, 2548, 2549, 2550, 2551, 2552, 2553, 2554, 2555, 2556, 2557, 2558, 2559, 2560, 2561, 2562, 2563, 2564, 2565, 2566, 2567, 2568, 2569, 2570, 2571, 2572, 2573, 2574, 2575, 2576, 2577, 2578, 2579, 2580, 2581, 2582, 2583, 2584, 2585, 2586, 2587, 2588, 2589, 2590, 2591, 2592, 2593, 2594, 2595, 2596, 2597, 2598, 2599, 2600, 2601, 2602, 2603, 2604, 2605, 2606, 2607, 2608, 2609, 2610, 2611, 2612, 2613, 2614, 2615, 2616, 2617, 2618, 2619, 2620, 2621, 2622, 2623, 2624, 2625, 2626, 2627, 2628, 2629, 2630, 2631, 2632, 2633, 2634, 2635, 2636, 2637, 2638, 2639, 2640, 2641, 2642, 2643, 2644, 2645, 2646, 2647, 2648, 2649, 2650, 2651, 2652, 2653, 2654, 2655, 2656, 2657, 2658, 2659, 2660, 2661, 2662, 2663, 2664, 2665, 2666, 2667, 2668, 2669, 2670, 2671, 2672, 2673, 2674, 2675, 2676, 2677, 2678, 2679, 2680, 2681, 2682, 2683, 2684, 2685,

[illegible][illegible][illegible][illegible]

ಎಲ್ಲಿ $\phi = \phi_1 + i\phi_2$ ಎಂದಾಗ ϕ_1 ಮತ್ತು ϕ_2 ಸ್ಥಳೀಯ ಫಲನಗಳು ಆಗಿರುತ್ತವೆ.

ANGAR DECOR LIMITED
CIN: L36998GJ1995PLC028139
ATS OPP-DHARNIDHAR TEMPLE, AHMEDABAD, Gujarat, India, 380007.

For the Quarter Ended	For the Half year ended	For the year ended
-----------------------	-------------------------	--------------------

30/09/2025	30/06/2025	30/09/2024	30/09/2025	30/09/2024	31/03/2025
Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited

270.05	241.41	345.89	511.46	529.13	1858.95
49.77	19.75	105.90	68.52	118.32	127.55

49.77	19.75	105.90	69.52	118.37	127.55
-------	-------	--------	-------	--------	--------

16.44	12.24	78.36	28.67	87.56	89.91
-------	-------	-------	-------	-------	-------

16.44	12.24	78.36	28.67	87.56	00.91

4896.16	4896.16	612.02	4896.16	612.02	4896.16
1.00	1.00	5.00	1.00	5.00	1.00

of the detailed format of Quarterly and Half Yearly Financial Results as under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The

Half Yearly Financial Results are available on the Stock Exchange
n. and the same is also available on the company's website. Le
full result is also available by scanning the below mentioned QR

Samirbhai Shah
Managing Director
DIN: 00787630


Aadhar
 Unique Identity

આદિ સોભા જોડા, મોબાઈલ નં. ૯૮૪૮૭૭૦૦૦૭

કુલ પાઠ્યપિત્ર ૩૪,૦૭-૬૨-૧૦૫૪ ગુજરાત	અભયર વિદ્યાકલની વિદ્યાથી
---	--------------------------

12.13.036/-

આ પણ જાણવા માટે, અભિયાનકર્તાઓએ સારું વિચારવું જોઈ શકે છે કે આપણને કયો વસ્તુ મળી રહેશે, તેથી જોઈ શકાય છે. આથી જ આપણે એવી જગ્યાએ જઈએ છીએ જેના પરથી જોઈ શકાય તેવાં ચિત્રો બહુ ઓછા પડે છે. આથી જ આપણે એવી જગ્યાએ જઈએ છીએ જેના પરથી જોઈ શકાય તેવાં ચિત્રો બહુ ઓછા પડે છે. આથી જ આપણે એવી જગ્યાએ જઈએ છીએ જેના પરથી જોઈ શકાય તેવાં ચિત્રો બહુ ઓછા પડે છે.

[illegible]

(**અધિકૃત અધિકારી**)
સહી, આમતર યાદગીરન કાલ-આજના વિશિષ્ટતા



ગોલ્ડ લોન

PUBLIC NOTICE

The branch of IIFL Finance Ltd., located at Ground Floor Shop No. 7, Classic Height, Juhapura (Sarkhej) Road, Ahmedabad, Gujarat - 380055 will be shifting to below mentioned address with effect from 11.02.2026.

New Address: IIFL Finance Ltd., Ground Floor, Shop No. 32, Himadaya Falaknuma, Sarkhej, Ahmedabad, Gujarat - 380055

Contact No. 9904081983 / 9898298898

All existing services can be availed at the new location.


ગરેજ નોટિસ

આઇ. આઇ. એફ. એલ. ફાઇનાન્સ લિમિટેડ ની અમદાવાદ - સરખેજ જી.એલ. - ખાતે આવેલી શાખાનું સ્થળાંતર કરી રહ્યા છીએ જેનું જૂનું સરનામું આઉટડ્ર ફ્રન્ટ શોપ નંબર 7, ક્લાસિક હાઇટ, જુહાપુરા સરખેજ રોડ, અમદાવાદ, ગુજરાત - 380055 નું ખંદેજ તારીખ 11.02.2026 થી સ્થળાંતર થશે

નવું સરનામું- આઇ. આઇ. એફ. એલ. ફાઇનાન્સ લિમિટેડ, આઉટડ્ર ફ્રન્ટ, ફક્કાન નંબર 32, હિમાયત ફલકનુમા, સરખેજ, અમદાવાદ, ગુજરાત - 380055.

સંપર્ક: 9904081983 / 9898298898

કોઇની નમુના વર્તમાન સેવાઓ નવા સ્થળે ઉપલબ્ધ થશે.

**PHYSICAL POSSESSION NOTICE**

Branch Office : ICICI Bank Ltd. Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No. B3, WIFIT I PARK, Wagle Industrial Estate, Thane (West)- 400604.

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.


Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs)	Name of Branch
1.	M/s. Neel Trading Co./ Mr. Jayantilal L Faldru/ Mrs. Manjulaben Jayantilal Faldru/ Mr. Ashok Jentilal Faldru/ 791305500030	Property 1: Residential Tenement Constructed on City Survey No. 3273, Sheet No. 50, Taluka & Sub-Registration District Kalavadi, Registration District Jamnagar, Gujarat- Owned by Manjulaben Jayantilal Faldru./ Admeasuring Area 139.35 Square Meter/ North: Property bearing C. S. No. 3272, South: Property bearing C. S. No. 3275, East: River, West: Road Property 2: Residential Tenement Constructed on City Survey No. 3293, Sheet No. 53, Taluka & Sub-Registration District Kalavadi, Registration District Jamnagar, Gujarat- Owned by Jayantilal Limbabbhai Faldru./Admeasuring Area 280.90 Square Meter/ North: Property of Dineshbhai Changani, South: Property of Vallabbhbhai Vasoya East: Road West: Road/ November 09, 2025	April 11,2025/ Rs. 82,56,289.17	Kalawadi

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: November 13, 2025
Place: Jamnagar

Sincerely Authorised Officer,
For ICICI Bank Ltd.

**PHYSICAL POSSESSION NOTICE**

Branch Office : ICICI Bank Ltd. Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No. B3, WIFIT I PARK, Wagle Industrial Estate, Thane (West)- 400604.

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.


Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs)	Name of Branch
1.	M/s. Shree Matangi Contruction/ Mr. Pareshkumar Kantilal Jani/ Mr. Vipul N. Shah/ Mr. Bhadril Vitthalbhai Patel/ Mr. Lav Rameshbhai Patel/ Mrs. Ritoben Rameshbhai Patel/ 771305000121	Property 2: Flat No. 303, 3rd Floor, Nisarg Residency, In The Society Known As Shriji Darshan Constructed on N. A. Land Bearing Revenue Survey No. 164/2, 165/3, 165/4, City Survey No. 1065, 1066 and 1064, Sub- Plot No. 14 and 15, Moje Village Tandajla, Sub- Registration District Akota Vadodara (Division-3) of Registration District Vadodara, Gujarat- Owned By Mr. Vipul N. Shah/ Admeasuring Built Up Area 47.33 Square Meter Along With Undivided Proportionate Share in Land 29.61 Square Meter/ North: Revenue Survey No. 164/1, South: Flat No. 301 & 302, Lift and Common Passage, East: Sub- Plot No. 7, West: 7.50 Meter Society Road/ November 09, 2025	June 12, 2025 Rs. 1,41,13,164.97/-	Ahmedabad

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: November 13, 2025
Place: Ahmedabad & Vadodara & Bhavnagar

Sincerely Authorised Officer,
For ICICI Bank Ltd.

**POSSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 08.07.2025 calling upon the borrower **Mr. Vikas Bansiljali Rajpurohit (Borrower) and Mrs. Raju Kanwar (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 26.07,200.23** as on 07.07.2025 + unpaid interest thereon + Legal & other Expenses within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the **10th day of November of the year 2025**.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda, DB Kamrej Branch** for an amount of **Rs. 26.07,200.23** as on 07.07.2025 + an unpaid interest there on + Legal & other Expenses.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of Immovable Property bearing Flat No. B/1/501 (as per sanctioned plan Flat No. 505), admeasuring around 1288 Sq. ft. of Super built-up area & 76.95 sq. meters of built-up area on the 5th Floor of Building No. B/1 of C-Type of 'Shree Vinayak Residency', situated on the land bearing Sub-Plot No. 1 of the land bearing R.S. No. 186, Block No. 190 paiki Southern side of Village - Mota Varachha, Sub Dist. Surat City (Chorasi), Dist. Surat. Stands in the name of Mr. Vikas Bansiljali Rajpurohit and Mrs. Raju Kanwar. **Bounded by :- East : F.P. No. 49, North : Building No. B/2, West : Shree Vinayak Arcade, South : Building No. A.**

Sd/-
Date : 10.11.2025, Place : Surat
Authorised Officer, Bank of Baroda

**BAFNA PHARMACEUTICALS LIMITED**
CIN : L24294TN1995PLC030698
Regd. Off: No.299, Thambu Chetty Street, Chennai-600 001, Tel: 044 - 2526 7517 / 2527 0992 / Fax: 044 25261264, E-mail: info@bafnapharma.com, Website: www.bafnapharma.com

Extracts of Unaudited Financial Results for the Quarter And Half Year ended September 30, 2025
(Rs. In Lakhs) Except EPS

S. No.	Particulars	Quarter Ended			Half Year Ended		
		30.09.2025 Unaudited	30.06.2025 Unaudited	30.09.2024 Unaudited	30.09.2025 Unaudited	30.09.2024 Unaudited	31.03.2025 Audited
1	Total Income from operations	3,546.82	3,462.40	4,032.31	7,009.22	7,360.94	14,585.70
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	312.49	338.89	261.74	651.38	223.92	629.81
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	312.49	338.89	261.74	651.38	189.42	415.25
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	312.49	338.89	261.74	651.38	189.42	415.25
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	307.87	334.27	262.65	642.14	191.25	396.75
6	Equity Share Capital	2,365.63	2,365.63	2,365.63	2,365.63	2,365.63	2,365.63
7	Other Equity as per the Audited Balance Sheet of the previous year (excluding Revaluation Reserve)	--	--	--	6,757.16	5,909.46	6,115.02
8	Earnings Per Share Basic :	1.32	1.43	1.11	2.75	0.80	1.76
	Diluted :	1.32	1.43	1.11	2.75	0.80	1.76

Note: i). The above is an extract of the detailed Statement of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2025 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The detailed Results are available on the website of the Stock Exchanges and on the Company's website. The Results can also be accessed by scanning the below QR Code. ii). Exceptional items for the year ended 31st March 2025 represents: (a) Derecognition of certain inventory items amounting to Rs.37.56 Lakhs; (b) Derecognition of Intangible Asset under Development amounting to Rs.177 Lakhs. iii). The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 11, 2025.

**For BAFNA PHARMACEUTICALS LIMITED**
SD/- S Hemalatha
Whole Time Director
(DIN: 02714329)

Place : Chennai
Date : 11.11.2025

**TAMILNAD MERCANTILE BANK LTD.**
Ground floor,Shree Krishna Avenue, Opp. Town Hall, Jamnagar, Gujarat – 361001
Ph:+91-7069004588, 0288-2554827,28 CIN: L65110TN1921PLC001908

Jewel Auction Notice

The person mentioned below has availed the benefit of Jewel Loan by pledging his jewellery at our Jamnagar branch. After the due date of the Jewel Loan, the Jewel Loan has not been recovered and has not been settled till date. Registered post has been delivered to the address of the borrowers in which interest, costs and principal which has to be paid. Therefore, on seeing this advertisement, the concerned person has to repay the loan on or before 27.11.2025 otherwise, we inform you that the jewellery will be sold at our branch by public or private auction before 27.11.2025 at 1.00 PM. The bank reserves the right to suspend, reschedule or postpone the auction and this notice shall also apply to the respective heirs in case of death of the borrower. If the amount of sale of the jewellery is more, it will be credited to their direct or indirect loan liability

S. No	Name and Address of the Borrower	Loan Amount	Amount due as on 06.11.2025	Weight of Jewels
1.	MUTHUMANIKANDAN R. S/O-RAMSAMY 6/714/3-3. MANICKAVASAGAR STREET LAKSHMI NAGAR, VIRUDHUNAGAR, TAMILNADU – 626001. (493700300100646)	Rs.90,000/-	Rs.1,00,162.92	22.00 Grams


Note: The Bank reserves the right to conduct or cancel the above auction. If the auction is not concluded on the specified time or on the same day, it will be continued on the next day without further notice on the same terms and conditions. Bidders will have to bring proof of identity, proof of address and PAN card. Bidders will pay the amount inclusive of GST. Bidders will have to pay the full bid amount in the bank on the day of auction.
Place: Jamnagar
Date: 11.11.2025

Branch Head
Tamilnad Mercantile Bank Ltd, Jamnagar Branch


SHANGAR DECOR LIMITED
CIN: L36998GJ1995PLC028139
Registered Office:4 SHARAD FLATS OPP-DHARNIDHARTEMPL, AHMEDABAD, Gujarat, India, 380007.
(O):9825023622, 9825031622 (E): shangardecorltd@hotmail.com (W): www.shangardecor.com
Statement of Unaudited financial results for the Quarter ended on 30/09/2025 - (Rs. In Lakhs except EPS)

Sr. No	Particulars	For the Quarter Ended			For the Half year ended			For the year ended
		30/09/2025 Unaudited	30/06/2025 Unaudited	30/09/2024 Unaudited	30/09/2025 Unaudited	30/09/2024 Unaudited	31/03/2025 Audited	
1	Total income from operations (net)	270.05	241.41	345.89	511.46	529.13	1858.95	
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	49.77	19.75	105.90	69.52	118.37	127.55	
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	49.77	19.75	105.90	69.52	118.37	127.55	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	16.44	12.24	78.36	28.67	87.56	80.91	
5	Total Comprehensive income for the period (after Tax)	16.44	12.24	78.36	28.67	87.56	80.91	
6	Equity Share Capital	4896.16	4896.16	612.02	4896.16	612.02	4896.16	
7	Face Value of Equity Share Capital	1.00	1.00	5.00	1.00	5.00	1.00	
8	Earnings Per Share (Basic / Diluted)	0.00	0.00	0.64	0.01	0.72	0.17	

Note: The above is an extract of the detailed format of Quarterly and Half Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly and Half Yearly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com. and the same is also available on the company's website i.e. www.shangardecor.com. The full result is also available by scanning the below mentioned QR Code.

**For, SD/- Samirbhai Shah Managing Director DIN: 00787630**

Date: 12.11.2025
Place: Ahmedabad

**HDFC BANK LIMITED**
We understand your world

Regd. Office: Bank House, Senapati Bapat Marg, Lower Parel (W), Mumbai 400 013.
Dept For Special Operation - Peninsula Business Park, B Tower , 4th floor, Dawn Mills Compound, Ganpat Rao Kadam Marg, Lower Parel (West) Mumbai: 400 013.

POSSSESSION NOTICE (FOR MOVABLE PROPERTY)

Whereas the Authorized Officer of the **HDFC Bank Ltd.** having office at Peninsula Business Park, B-Wing, 4th Floor, Ganpat Rao Kadam Marg, Lower Parel (West), Mumbai 400 013. Under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act' 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 9 of Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 19-08-2014** calling upon the Borrower and Guarantors viz. **M/s Vasanti Share Brokers Limited, Mr. Basant Rungta and Mr. Ashok Rungta** to repay the amount mentioned in the notice being **Rs.3,65,94,902.83 (Rupees Three Crore Sixty Five Lakh Ninety Four Thousand Nine Hundred Two and Paise Eight Three Only)** along with further interest & penal interest thereon from **01-08-2014** at the contractual rate and incidental expenses & cost, within **60 days** from the date of the said notice.

The borrower having failed to repay the said amount, notice is hereby given to the borrower and the public in general that pursuant to the order of the **Chief Judicial Magistrate, Ahmedabad, Gujarat passed on 29-12-2016, the undersigned has taken Physical Possession** of the property described herein below on **08-11-2025** through **Court Commissioner, Ahmedabad, Gujarat** in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The Borrower, Guarantors and Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of **HDFC Bank Ltd., for an amount of Rs.3,65,94,902.83** and applicable future interest thereon, from 01-08-2014 till realization.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Description of the Immoveable Property

All that piece and parcel of the Immoveable property bearing Office No. B/102, "B" wing, Doctor House, Near Parimal Railway Station Crossing, Ellisbridge, Ahmedabad-380006, Gujarat Admeasuring 720.55 Sq. Ft. The property is **bounded as under:-** Towards East : By Common wall, Towards West : By Common passage, Towards North : By Office No. B/1/04, Towards South : By Common wall.

Date: 08-11-2025
Place : Ahmedabad, Gujarat

Priyanka Kapadia
Authorized Officer
For HDFC BANK LTD.

**HDFC Bank Limited**
We understand your world

Branch : 4th Floor, C Wing, Sheetal Westpark Imperia, Besides Alpha One Mall, Near Vastrapur Lake, Vastrapur, Ahmedabad, Gujarat- 380052

POSSSESSION NOTICE

Whereas the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC), under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("said Act") and in exercise of powers conferred under Section13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues	Date of Demand Notice	Date of Possession	Description of Immovable Property (ies) / Secured Asset (s)
A	B	C	D	E	F
1	MR ROHIALW SAJJAN BHANWARI (Borrower) MRS DARSHNA (Co-Borrower)	Rs. 27,01,373/-and Rs. 2,22,021/-dues respectively as on 28-Feb-2025*	03-APR-2025	09-NOV-25 (Physical Possession)	HOUSE 73, PLOT 73, S NO 90/P-1/P-2, COLONY SIDDHESHWAR RESIDENCY, VILLAGE MEGHPAR KUMBHARDI, TALUKA ANJAR, ANJAR, GANDHIDHAM - 370110
2	MR SONI BRIJESHKUMAR KIRTILAL (Borrower) MRS SONI CHHAYABEN KIRTILAL (Co-Borrower)	Rs. 13,04,201/- and Rs. 1,10,894/- dues respectively as on 28-Feb-2025*	26-MAR-2025	09-NOV-25 (Physical Possession)	UNIT-51, PLOT-51, REVENUE SURVEY NO. 181/2, S NO 181/2, VILLAGE-MEGHPAR BOROCCHI, TALUKA-ANJAR, KUTCH - 370110

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation. However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorised Officer(s) of HDFC have taken physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets/.

Copies of the Pnachama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 12.11.2025
Place : Kutch-Gandhidham

Sd/-
For HDFC Bank Ltd.
Authorised Officer,

Regd Office: HDFC Bank Ltd., HDF Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618 Website: www.hdfcbank.com

**HINDUJA HOUSING FINANCE**

Corporate Office: No. 167-169, 2nd Floor, Anna Salai, Saidapet, Chennai-600015

Branch Office: 3rd, Floor, IFCCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Mr. Shivranganji Cross Road, Satellite, Ahmedabad-380015

Saurabhkumar Naito Mo.8790029384, Vikas Savariya Mo. 7984982904, Hitesh Kumar Patel Mo.7048336601, Sushil Chaudhary Mo. 8118818160, Nitin Samudre M. 8128310678, Trishul Patel Mo. 9664692923, Shivam Mishra M. 9033015277 E-mail auction@hindujahousingfinance.com

Possession Notice - As per Appendix IV

Whereas, The undersigned being the Authorized Officer of Hinduja Housing Finance Limited (HHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued the Demand Notice under section 13(2) calling upon the borrowers to repay the amount mentioned in the notice alongwith further charges, interest etc. within 60 days from the date of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security interest Enforcement Rules, 2002.


Sr. No.	Name of the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount / Loan Account No.	Date & Type of Possession	Schedule of the Property
1	Borrower: (1) Mr. Aniruddhshin Jadeja Co-borrower: (2) Mr. Mahipatsinh Jadeja (3) Mrs. Sankutlaba Jadeja	Dt. 11/08/2025 & Rs. 5,99,907/- & A/C No. GJ/AMD/GDDM/A000000385	07.11.2025 Symbolic Possession	All that pieces and parcels of immovable property comprising of a Plot of land for residential purpose bearing Gram Panchayat Milkat No. 2/35, admeasuring 47-44 Square Meters, AND Gram Panchayat Milkat No. 2/36, admeasuring 47-44 Square Meters, situated at the Gam Tal area of village Nani Khakhar of Taluka Mandvi of the district KUTCH and bounded as under: Four Boundaries of the Property Gram Panchyat Milkat No.2/35 :- SURROUNDED ON NORTH BY: Public Road is situated, SURROUNDED ON SOUTH BY: Gram Panchayat Milkat No. 2/36 thereafter Ravechi Mata Temple is situated, SURROUNDED ON EAST BY: Public Road is situated, SURROUNDED ON WEST BY: Gully is situated.
2	Borrower: (1) Mr. Khushalpur Givsvami Co-borrower: (2) Mrs. Saheliben Givsvami (3) Mrs. Savitri Givsvami	Dt. 11/08/2025 & Rs.5,91,191/- & A/C No. GJ/GDD/BBHU/A0000000216	07.11.2025 Symbolic Possession	All that pieces & parcels of immovable property comprising of a Plot of land for residential purpose bearing Gram Panchyat Milkat No. 824/1, admeasuring 204.92 Square Meters with construction,
3	Borrower: (1) Mr. Ramesh Kanzariya Co-borrower: (2) Mrs. Hansaben Kanzariya	Dt. 11/08/2025 & Rs. 25,15,824/- & A/C No. GJ/MRB/TRJP/A0000000072	10.11.2025 Symbolic Possession	All Part And Parcel Of Immovable Non-Agriculture Survey No.1346 P., & Survey No.1347 P., Plot No.1, Area 141-61 Sq. Mt. Situated At Village-
4	Borrower: (1) Mr. Paresh Joshi Co-borrower: (2) Mrs. Vidyaben Joshi	Dt. 11/08/2025 & Rs. 7,44,410/- & A/C No. GJ/AMD/GDDM/A0000000549	11.11.2025 Symbolic Possession	All that piece and parcel of the property being Plot No. 282 admeasuring 75.30 square meters, and a Residential House appurtenant to it situated on the Non Agricultural Land bearing Revenue Survey No.757, lying in Sim

situated at the Gam Tal area of village MOTAASAMBIYA of **Taluka MANDVI of the District KUTCH** and with bounded as under. North: Road is situated. South Varanda' of BahadursinliJuvansinh is situated. East Open Plot of Shivi Tapubhai is situated, West Residential House of Jusab Abdulla is situated.

of Town Bhachau of Sub- district Bhachau of the District Kutch Four Boundaries of the Property:- SURROUNDED ON NORTH BY: PLOT No. 281 is situated. SURROUNDED ON SOUTH BY: PLOT No. 283 is situated. SURROUNDED ON EAST BY: PLOT No. 37 is situated. SURROUNDED ON WEST BY: 6.00 Meter Wide Internal Road thereafter, plot no. 261 is Situated.

Place : Gujarat
Date : 13.11.2025

Authorized Officer
For, Hinduja Housing Finance Limited

**1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002.**

Public Notice - Tender cum E-Auction for Sale of Secured Asset/ Assets

[See proviso to rule 8(6)]
Notice for sale of immovable asset(s)

This E-Auction Notice for Sale of Immovable Asset/ Assets is being issued by ICICI Bank Ltd. (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd. (DHFL) in relation to the enforcement of security with respect to a Housing Loan facility granted pursuant to a Loan Agreement entered into between DHFL and the following Borrowers/ Co-Borrowers/ Guarantors under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

The Notice is hereby given to the public in general and in particular to the Borrower/ Borrowers/ Co-Borrower/ Co-Borrowers/ Guarantor/ Guarantors that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Ltd. will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' basis as per the brief particulars given below:-

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ Guarantors / Loan Account No.	Details of the Secured Asset/ Assets with known encumbrances, if any	Outstanding Amount	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Jagaram N Jot (Borrower) Jamudevi Jagdikumar Jot (Co-Borrower) Loan A/c No. Qzbrd00005019465	Flat No. A/404, 4th Floor, Wing A, Dharambhakti Residency, Opp Sai Swami Residency, Kim Main Road, Opp Swami Narayan Temple, Kudsad, Ramnagar, Block No. 799, Plot No. 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, Surat 394110 (admeasuring An Area Of Builtup Area 87.08 Sq.mtr)	Rs.1739587/- (as on 06 November 2025)	Rs. 910000/- Rs. 910000/-	November 20, 2025, From 10:00 AM To 11:00 AM	December 09, 2025 From 11:00 AM Onwards
2.	Hardik Bharatbhai Solanki (Borrower) Pujaben Hardikbhai Solanki (Co-Borrowers) Loan A/c No. Qzsur00005013410	Flat No. 406, 4th Floor, Building No. A, Harikrushna Residency, Near Railway Crossing, Block No. 338/b, Umra, Olpad , Surat 394210 (admeasuring An Area Of Super Builtup Area 975 Sq.ft., i.e 90.61 Sq.mtr)	Rs. 14,00,055/- (as on 06 November 2025)	Rs. 5,10,000/- Rs. 51,000/-	November 20, 2025, From 10:00 AM To 11:00 AM	December 09, 2025 From 11:00 AM Onwards

The online auction will take place on the website <https://disposalhub.com> of the E-Auction agency **M/s NexXen Solutions Private Limited**. The recipients of this Notice are given a last chance to pay the total dues with further interest till **December 08, 2025 before 04:30 PM** failing which, the Secured Asset/ Assets will be sold as per schedule.

The prospective Bidder/ Bidders must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer to column E) at ICICI Bank **ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002**, on or before **December 08, 2025 by 04:30 PM**. Thereafter, he/ she/ they need to submit the offer/ offers through the website mentioned above on or before **December 08, 2**